

27 જૂન 2018

પર્સનલ ટ્રાન્સપોર્ટેશન કંપનીઓને લાયસન્સ આપવા માટે કાઉન્સિલની મંજૂરી

બ્રમ્પટન, ઓન્ટારિયો – બ્રમ્પટન સીટી કાઉન્સિલે આજે મોબાઇલ લાયસન્સિંગ ઉપનિયમમાં સુધારાને મંજૂર કરીને નવા પર્સનલ ટ્રાન્સપોર્ટેશન કંપની (PTC) વાહન લાયસન્સ વર્ગનું સર્જન કર્યું. નવા વર્ગ હેઠળ, રાઇડ-શેરિંગ કંપનીઓ જેમકે ઊબર (Uber) અને લિફ્ટ (Lyft) હવે કાયદેસર રીતે બ્રમ્પટનમાં કામ કરી શકશે.

ગ્રાહકો, ટેક્સ ઉદ્યોગ અને PTCની રૂચિઓ અને જરૂરિયાતો સમતોલ રહે તેની ખાતરી કરવાના આશયથી કર્મચારીઓએ મોબાઇલ લાયસન્સિંગ ઉપનિયમની સમીક્ષા શરૂ કરી હતી. સમીક્ષામાં ઉપનિયમમાં સુધારા લાવવા માટે ધ્યાન પર લેવામાં આવેલ મુદ્દાઓમાં વ્યાપકપણે હિસ્સેદારોનો સહભાગ અને અન્ય નગરપાલિકાઓની શ્રેષ્ઠ પ્રણાલિઓને બેન્યમાર્ક કરવાનું સામેલ હતું.

આ સમીક્ષા હાથ ધરવામાં આવી ત્યારે જાહેર જનતાની સલામતી અને ગ્રાહક સુરક્ષા અતિમહત્વપૂર્ણ અગ્રતાઓ હતી. નવા વાહન લાયસન્સ વર્ગમાં જરૂરી છે કે PTC વાહનચાલક અને વાહનની માહિતી એકત્રિત કરે અને ઉપનિયમની જરૂરિયાતો પૂર્ણ કરે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા તમામ વાહનોને ઝીણવટથી ચકાસે. જે વાહન ચાલકો PTCના ઓપ્સ પર રહેવાની અરજી કરે તેઓ તમામ પર PTC સીટીની લાયસન્સિંગ શ્રેષ્ઠોલ્ડ નીતિ લાગુ કરશે જેમાં વાહનચાલકના રેકોર્ડ ચેક તેમજ ગુન્હાહિત પૃષ્ઠભૂની ચકાસણીનો સમાવેશ થાય છે. PTCએ વીમાનો પુરાવો આપવો જરૂરી છે અને તેઓએ સીટીને તેમની કોઈ પણ નીતિઓમાં ફેરફારો થાય તે જાણાવવાનું રહેશે. જો કોઈ PTC વાહનચાલક પાસે તેમની પોતાની કમર્શ્યલ વીમા પોલિસી હોય તો PTC માટે તે તમામ સમયે માન્ય હોય તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે જ્યારે પણ તે વાહન ચાલક ઓપનો ઉપયોગ કરતા હોય. PTC સાથે સંલગ્ન વાહનો આ મુજબના હશે:

- મહત્તમ સાત વર્ષ જૂના હશે
- ટૂંક એટલેકે ડીકીમાં વહીલચેર અથવા અન્ય હિલચાલના ઉપકરણો આવી શકે એટલી ક્ષમતા હોવી જોઈશે
- લાયસન્સ જારી કરનાર દ્વારા મંજૂર કરેલ ઓળખ સૂચક એટલેકે આઈડેન્ટિફાયર દર્શાવવાનો રહેશે.
- PTC દ્વારા જારી થયેલ માન્ય અળખ કાર્ડ પર સૂચિત હશે જેમાં વીમા આવરણનો સમાવેશ થશે

ઉપનિયમ હેઠળ, PTCના કોઈ મહત્તમ કે લઘુત્તમ દર નહીં હશે. લાગુ હોય તેવી કોઈ પણ સર્જ પ્રાઈસિંગ (જેમાં માંગના આધારે દર બદલાય) સહિતના દરની તેઓએ ગ્રાહકને જાણ કરવાની રહેશે અને ગ્રાહક દ્વારા વિનંતી કરવામાં આવે તેવા સવારીના અંદાજીત દર પૂરા પાડવાની રહેશે. PTCએ તેમના વેબપેજ પર પણ દર સૂચિત કરવા જરૂરી છે અને કોઈ પણ શુલ્કો હોય તે છૂટા દર્શાવીને ગ્રાહકોને રસીદો પૂરી પાડવાની રહેશે.

રાઇડ શેરિંગ કંપનીઓના લાયસન્સિંગથી બ્રમ્પટનના ખાનગી પરિવહન ઉદ્યોગમાં સ્પર્ધાત્મકતા અને ઈનોવેશન વધશે અને શહેરના યુવાન ટેકનોલોજીમાં માહેર અને ઝડપથી વધતી નિવાસી વસ્તીની પરિવહનની જરૂરિયાતો સુરક્ષિત રીતે પૂર્ણ કરશે. કર્મચારીઓ PTC પર અનુપાલન માટે એકધારી દેખરેખ રાખશે અને લાયસન્સિંગના સમયપત્રકમાં કોઈ પણ ફેરફારો કરવા માટે આશરે એક વર્ષમાં કાઉન્સિલને અહેવાલ આપશે.

બ્રેમ્પટનની PTC અને મોબાઇલ લાયસન્સિંગ ઉપનિયમ વિશેની વધુ જાણકારી માટે અહીં મુલાકાત લો www.brampton.ca

ક્વોટ:

"બ્રેમ્પટનની વસ્તી ઝડપથી વધી રહી છે અને આપણા નાગરિકો વધુ લવચીક પરિવહનના વિકલ્પો માંગી રહ્યા છે જેથી શહેર અને બહાર જઈ શકાય. ટેક્સ એડવાયઝરી કમિટીએ કાઉન્સિલ વતી બહુ મહેનત કરી છે, હું આ કમિટીના દરેક સદસ્યોનો આભાર માનું છું. કમિટીની વ્યાપક પરામર્શ પ્રક્રિયા મારફત સીટી મોબાઇલ લાયસન્સિંગ ઉપનિયમનું સર્જન કરી શક્યા જે જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને સાથે જ અસરકારક રીતે રહેવાસીઓ અને મુલાકાતીઓની પરિવહનની જરૂરિયાતો સંતોષે છે."

- મેયર લિન્ડા જેફી

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારો છે. અમે તીક્ષ્ણ ફેક્ટસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો યાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://www.facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.